



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૨/૦૬/૨૦૧૯ રવિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૯૪૨/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૯૫ કેસ કરી, ૭૭ વ્યક્તિઓને ઝડપી, ૨૯૧ લીટર દેશી દારૂ અને ૧ સ્ફૂટર કબજે કર્યું હતું. તેમજ જુગાર ધારા હેઠળ ૩ કેસ કરી ૩ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૧૫,૭૦૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૯૪૩/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૫૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી-૯૩ મુજબ ૩ અને પાસા હેઠળ ૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

છેતરપીંડીની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૯૪૪/૧૯

વસ્ત્રાપુર: ટોમ્સ સ/ઓ દાસ થોમસ બંડી (રહે.રાહુલ ફ્લેટ નિર્માણ સ્કુલ સામે પાણીની ટાંકીની બાજુમા વસ્ત્રાપુર) એ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોધાવી છે કે તા.૦૧/૦૬/૧૯ બપોરના ૩/૪૫ વાગ્યાના સુમારે WWW.GRAHAKSURAKSHA.COM નામની ગ્રાહક સુરક્ષાની વેબ સાઇટ પરથી આરોપી WILLORA કંપનીના કસ્ટમર કેર હેલ્પ લાઇન નંબર (૧) ૦૭૭૩૯૮૬૦૪૯૫ (૨) ૯૬૬૨૯૮૪૪૦૧ પરથી વાત કરનાર વ્યક્તિએ ટોમ્સ બંડીને ફોન કરી ચેનકેન પ્રકારે વાતોમાં લાવી વિશ્વાસ કેળવી ગુગલ-પે નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહી ઓનલાઇન ખાતામાંથી ટુકડે-ટુકડે રૂપિયા ૩૭,૬૧૪/- ટ્રાંજેક્શન કરી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એમ.એમ.જાડેજા ચલાવે છે.

ઘાટલોડીયા: મુકેશભાઈ ટાપુભાઈ લોહિયા (રહે. મેહનતપુરા લીલાબેનની ચાલી આંબાવાડી એલીસબ્રીજ) એ તા.૦૧/૦૬/૧૯ નારોજ ઘાટલોડીયા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોધાવી છે કે ભાગીદારીમાં ધંધો કરતા આરોપી રાજુભાઈ નાનજીભાઈ સોનદર્વા (રહે.નિર્ણયનગર ઘાટલોડીયા) માહે અપ્રિલ/૨૦૧૮ થી આજદીન સુધીના સમયગાળા દરમ્યાન બીલ્ડીંગના મેન્ટેનન્સના તથા મ્યુનિસીપલ ટેક્ષના પૈસા બાકી નીકળે છે તેમ કહી મુકેશભાઈની જાણ બહાર મેમેનગર વિવેકાનંદ સર્કલ દુકાન નં-૨૦/૨૧, યશ આર્યન ન્યુ સુખ સુવિધા પગરખા બજાર ખાતેથી મુકેશભાઈ તથા સાહેદ સંજયભાઈનો પગરખાનો માલ કિંમત રૂપિયા ૩૧,૦૩,૫૦૦/- લઈ જઈ વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી પી.આર.ગામીત ચલાવે છે.

સોલા હાઈકોર્ટ: રાજકુમારી વા/ઓ પ્રકાશચંદ્ર મુલતાની (ઉ.વ.૬૫) (રહે.સહજાનંદ સોસાયટી ડમરૂ સર્કલ પાસે ચાણક્યપુરી) એ તા.૦૧/૦૬/૧૯ નારોજ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે માહે ફેબ્રુઆરી/૨૦૧૯ થી આજદીન સુધીના સમયગાળા દરમ્યાન મોનીકાબેન વા/ઓ પંકજકુમાર આહુજા (રહે.સહજાનંદ સોસાયટી ડમરૂ સર્કલ પાસે ચાણક્યપુરી) એ રાજકુમારી મુલતાણીને વિશ્વાસમાં લઈ તેમના ખાતામાંથી અલગ-અલગ બેન્કના ખાતામાંથી રૂપિયા ૩,૫૦,૦૦૦/- ઉપાડી લઈ વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી વી.કે.મકવાણા ચલાવે છે.

લુંટની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૯૪૫/૧૯

વાડજ: દીપલ મલદેવભાઈ ઓડીદરા (ઉ.વ.૨૨) (રહે. આનંદ ડુપ્લેક્ષ ભાઈકાકનગર થલતેજ) એ તા.૦૧/૦૬/૧૯ નારોજ વાડજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૩૦/૦૫/૧૯ રાતના ૯/૧૫ વાગ્યાના સુમારે રીવરફ્રન્ટ ઉસ્માનપુરા ચાર રસ્તા નજીકથી અજાણ્યો પુરૂષ દીપલ ઓડીદરાના ગળામાંથી સોનાનો દોરો કિંમત રૂપિયા ૫૦,૦૦૦/- ખેચી તોડી લુંટ કરી નાસી ગયો હતો. આ ગુનાની તપાસ પો.ઈ.શ્રી જે.એ.રાઠવા ચલાવે છે.

ચોરી:-

સમાચાર યાદી નં.૯૪૬/૧૯

વેજલપુર: ભાવેશ સ/ઓ રમેશભાઈ કછવા (રહે. પંચશીલ જ્વેલર્સની પાછળ બુટભવાની મંદિર પાસે વેજલપુર ગામ) એ વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૩૧/૦૫/૧૯ કલાક ૯/૩૦ વાગ્યાના સુમારે જીવરાજપાર્ક સોસાયટી ખાતે આવેલ પોતાની શ્રી કંટેશ્વરી જ્વેલર્સ નામની ખુલ્લી દુકાનમાંથી બે હજાર રૂપિયાના છુદ્ધ પૈસા લેવા આવેલ બે પુરૂષ ભાવેશ કછવાની નજર ચુકવી દુકાનમાંથી સોનાના દાગીના કિંમત રૂપિયા ૧,૧૬,૦૦૦/- ચોરી કરી લઈ નાસી ગયા હતા. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી વી.કે.બારૈયા ચલાવે છે.

દાઝી જતા મૃત્યુ:-

સમાચાર યાદી નં.૯૪૭/૧૯

જીઆઈડીસી વટવા: વિનોદભાઈ શિવવમન શાહ (ઉ.વ.૩૬) (રહે. ગણેશનગર બચુભાઈના કુવા પાસે વટવા) તા.૨૭/૦૪/૧૯ નારોજ સેબુસ્ટ મશીનરી સોલ્યુશન વટવા જીઆઈડીસી નામની કંપનીમાં કંપનીમાં પેઇટીંગ માટે શિનરથી પોતુ મારતા હતા ત્યારે બાજુમાં ગેસ કટીંગનુ કામ ચાલતુ હતુ તેના તણખા ઉડતા દાઝી ગયા હતા. સારવાર માટે તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તા.૩૧/૦૫/૧૯ કલાક ૧૧/૦૦ વાગે તેમનુ મૃત્યુ નિપજયું હતુ. આ અંગે જીઆઈડીસી વટવા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી એમ.સી.જાડેજા ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૯૪૮/૧૯

અમરાઈવાડી: અમૃતભાઈ દેવજીભાઈ ચાવડા (ઉ.વ.૬૫) (રહે.શિતલનગર લાઇન નંબર-૩ બળીયાનગર સામે અમરાઈવાડી) એ અગમ્ય કારણસર તા.૩૧/૫/૧૯ કલાક ૮/૩૦ વાગે પોતાના ઘરે એસીડ પી લીધુ હતુ. સારવાર માટે તેમને સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયું હતુ. આ અંગે અમરાઈવાડી પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી મુકેશભાઈ જીવણભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.